



Information and translation provided in good
faith and correct at time of reviewing



General anaesthesia for Caesarean section



ઓબ્સ્ટ્રિક એનેસ્થેટિસ્ટ્સ એસોસિએશન

સિઝેરિયન વિભાગ માટે સામાન્ય એનેસ્થેટિક (સીએસ)

માહિતી પત્રક

આ પત્રક તમને સામાન્ય એનેસ્થેટિક થી આવતી ઊંઘ વિશે કેટલીક માહિતી આપવા માટે છે.

- સ્પાઇનલ એનેસ્થેટિક અથવા એપિડ્યુરલમાં મૂકવા માટે પૂરતો સમય ન હોય તો તાત્કાલિક સિઝેરિયન વિભાગમાં સામાન્ય એનેસ્થેટિકની વારંવાર જરૂર પડે છે.
- તમારી પાસે તમારા હાથમાં મૂકવા માટે એક સોય હશે જેને ઇન્ડ્રાવેનોસ (નસમાં આપવામાં આવતી) કેન્યુલા કહેવાય છે.
- સામાન્ય એનેસ્થેટિકનું એક જોખમ તે છે કે તમે ઊંઘી જાવ છો ત્યારે તમારા પેટ માંનું એસિડ તમારા ફેફસાંમાં જઈ શકે છે. આ જોખમ ઘટાડવા માટે, તમને એક ડ્રિપ દ્વારા અથવા તમારા પગ માં એક ઈન્જેક્શન આપવામાં આવી શકે છે, અને તમને પીવા માટે એન્ટિએસિડ દવા આપવામાં આવી શકે છે.
- ઓપરેટિંગ થિયેટરમાં તમે શ્વાસમાં ઓક્સિજન લો તે માટે એક માસ્ક તમારા ચહેરા પર મૂકવામાં આવશે. આ માસ્ક યુસ્ત લાગી શકે છે, પરંતુ તે તમને વધારે ઓક્સિજન આપવા માટે મહત્વનું છે.
- સામાન્ય એનેસ્થેટિક તમારા ડ્રિપ માં આપવામાં આવશે. તમે ઊંઘી જશો ત્યારે, તમને તમારી ગરદન પર દબાણ લાગશે. આ તમારા વાયુપથ અને ફેફસાના રક્ષણ માટે છે.
- તમારા જન્મ ભાગીદાર ઓપરેટિંગ થિયેટરમાં તમારી સાથે રહેવા માટે સમર્થ નહીં હોય, પરંતુ તેઓ નજીકમાં હશે.
- તમે રિકવરિ રૂમમાં જાગશો અને તમે જાગશો ત્યારે તરત જ તમારા બાળકને જોઈ શકો છો.
- તમે જાગશો ત્યારે, તમારું ગળું સુકાતું હોય તેવું લાગી શકે છે અને તમે માંદા હોવ તેવું લાગી શકે છે. જો તમારે તેમની જરૂર હોય તો વધુ પીડાનાશક અને માંદગી વિરોધી દવાઓ ઉપલબ્ધ થશે.

યુકેમાં દર વર્ષે, 17,000 સામાન્ય એનેસ્થેટિક્સ જે સ્ત્રીઓ સિઝેરિયન વિભાગમાં આવેલ છે અને બહુ થોડી ગૂંચવણો છે તેમને આપવામાં આવે છે. તેમ છતાં, સામાન્ય એનેસ્થેટિક્સના કેટલાંક જોખમો અને આડ-અસરો હોય છે. તે આ પત્રકની બીજી બાજુ પર દર્શાવવામાં આવેલ છે.

સામાન્ય એનેસ્થેસિયાના જોખમો અને આડઅસરો

શક્ય સમસ્યા	સમસ્યા કેટલી સામાન્ય છે
ધૂજારી	સામાન્ય - લગભગ 3 માંથી 1 લોકો
ગળું સુકાઈ જવું	સામાન્ય - લગભગ 2 માંથી 1 લોકો
માંદા હોઈએ તેવું લાગવું	સામાન્ય - લગભગ 10 માંથી 1 લોકો
સ્નાયુ નો દુખાવો	સામાન્ય - લગભગ 3 માંથી 1 લોકો
હોઠ અને જીભ પર ચીરા અથવા ઉઝરડા દાંત ને નુકસાન	પ્રાસંગિક - લગભગ 20 માંથી 1 લોકો ખૂબ જ દુર્લભ - લગભગ 4,500 માંથી 1 લોકો
તમે ઊંઘી જાવ ત્યારે એનેસ્થેટિસ્ટ શ્વાસનળી દાખલ કરવામાં નિષ્ફળ જાય છાતીમાં ચેપ એસિડ તમારા પેટમાંથી તમારા ફેફસામાં જતું રહે	અસામાન્ય - લગભગ 250 માંથી 1 લોકો સામાન્ય - 10 માંથી 1 લોકો - પરંતુ મોટા ભાગના ચેપ ગંભીર નથી ખૂબ જ દુર્લભ - લગભગ 1,000 માંથી 1 લોકો
પ્રક્રિયા દરમિયાન જાગી જવું	અસામાન્ય - લગભગ 400 માંથી 1 લોકો
ગંભીર એલર્જીક આડઅસર	દુર્લભ - લગભગ 10,000 માંથી 1 લોકો
મૃત્યુ અથવા મગજને નુકસાન	મૃત્યુ: ખૂબ જ દુર્લભ - 100,000 માંથી 1 કરતા ઓછું (ચુકેમાં એક વર્ષમાં 1 અથવા 2 લોકો) મગજને નુકસાન: ખૂબ જ દુર્લભ - ચોક્કસ આંકડાની જાણ નથી

આ બધા જોખમો અને આડઅસર માટે ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી. આંકડાઓ અંદાજીત છે અને એક હોસ્પિટલ થી બીજા હોસ્પિટલ પર બદલાય શકે છે. જો તમને કોઈ પ્રશ્નો હોય, તો તમારે તમારા એનેસ્થેટિસ્ટ સાથે આ અંગે ચર્ચા કરવી જોઈએ.

તમે રોયલ કોલેજ ઓફ એનેસ્થેટિસ્ટ્સની વેબસાઇટ www.rcoa.ac.uk પરથી 'સિઝેરિયન માટે એનેસ્થેસિયા'
પત્રિકા ડાઉનલોડ કરી વધુ માહિતી મેળવી શકો છો.

અમે ચેરિટી અનુવાદકના આભારી છીએ, જેઓએ કોઈપણ આર્થિક ફીસ વગર આ અનુવાદ અમને પુરો પાડ્યો છે.



© ઓબ્સ્ટેટ્રિક એનેસ્થેટિસ્ટ્સ એસોસિયેશન 2012

રજિસ્ટર્ડ ચેરિટી નંબર 1111382

www.labourpains.com